

Seat No.: \_\_\_\_\_

Enrolment No. \_\_\_\_\_

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**  
**Diploma Engineering - SEMESTER-I • EXAMINATION – SUMMER 2013**

**Subject Code: 3300001****Date: 03-06-2013****Subject Name:****Time: 02:30 pm - 05:00 pm****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of simple calculator is permissible(scientific/Higher version not allowed)
5. English version is authentic.

**Q.1** Fill in the blanks using appropriate choice from the given options: **14**

(1) Value of  $\log_a \frac{1}{\alpha}$  is \_\_\_\_\_.  
 (a) 0      (b) 1      (c) -1      (d) 2

(2) If  $\log_a 32 = 5$  then  $a = \underline{\hspace{2cm}}$ .  
 (a) 2      (b) 0      (c) 1      (d) -2

(3)  $a^{\log_a b} = \underline{\hspace{2cm}}$ .  
 (a) 0      (b) a      (c) b      (d) 1

(4) If  $A = \begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$  then  $A^T = \underline{\hspace{2cm}}$ .  
 (a)  $\begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$       (b)  $\begin{bmatrix} 0 & 0 \\ 0 & 0 \end{bmatrix}$       (c)  $\begin{bmatrix} 1 & 0 \\ 1 & 0 \end{bmatrix}$       (d)  $\begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$

The value of the  $\begin{vmatrix} \log_6 3 & -1 \\ \log_6 2 & 1 \end{vmatrix} = \underline{\hspace{2cm}}$ .

(5) (a) 0      (b) -1      (c) 1      (d) 2

If  $A = \begin{bmatrix} 2 & 1 \\ 5 & 3 \end{bmatrix}$  and  $B = \begin{bmatrix} 3 & -1 \\ -5 & 2 \end{bmatrix}$  then  $AB = \underline{\hspace{2cm}}$ .

(6) (a)  $\begin{bmatrix} 0 & 0 \\ 0 & 1 \end{bmatrix}$       (b)  $\begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$       (c)  $\begin{bmatrix} 1 & 0 \\ 1 & 0 \end{bmatrix}$       (d)  $\begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$

If  $\begin{vmatrix} x & 3 \\ -2 & 2 \end{vmatrix} = 2$  then  $x = \underline{\hspace{2cm}}$ .

(7) (a) 2      (b) -1      (c) -2      (d) -3

The period of  $3\cos 2x$  is \_\_\_\_\_.  
 (a) 0      (b)  $\pi$       (c)  $2\pi$       (d)  $3\pi$

(8) If  $\cos\theta + \sin\theta = 2$  then  $\sin 2\theta = \underline{\hspace{2cm}}$ .  
 (a) 1      (b) 2      (c) 3      (d) 4

(9)  $135^\circ = \underline{\hspace{2cm}}$  radian.  
 (a)  $\frac{\pi}{4}$       (b)  $\frac{3\pi}{4}$       (c)  $\frac{5\pi}{4}$       (d)  $\frac{5\pi}{6}$

(10)  $\tan^{-1}\left(\frac{3}{4}\right) + \tan^{-1}\left(\frac{4}{3}\right) = \underline{\hspace{2cm}}.$

(11) (a)  $\frac{\pi}{2}$       (b)  $\frac{3\pi}{2}$       (c)  $\pi$       (d) 0

) The area of a circle made from  $4\pi$  cm. long wire is \_\_\_\_\_.  
 )

- (a)  $\pi$       (b)  $4\pi$       (c)  $2\pi$       (d)  $3\pi$   
 Volume of a cone whose radius is 4 m. and height is 12m.is  
 $\text{m}^3$ .
- (12) (a)  $192\pi$       (b)  $48\pi$       (c)  $64\pi$       (d)  $74\pi$   
 ) Surface area of a cube of 5cm. length is  $\text{cm}^2$ .  
 (a) 25      (b) 125      (c) 100      (d) 150
- (13)  
 )
- (14)  
 )

**Q.2 (a)** Attempt any Two: 06

- (1) Solve:  $\log_2(x+5) + \log_2(x-2)=3$ .
- (2) Find the diameter of a sphere, if the total surface area of a closed Hemi-Sphere is  $462 \text{ m}^2$ . ( $\pi=\frac{22}{7}$ )
- (3) Diameter of a circular common plot of a college is 42 m. To raise the height of surface up to 10 cm, how many  $\text{m}^3$  clay is required?  
 ( $\pi=\frac{22}{7}$ )

**(b)** Attempt any Two: 08

- (1) If  $\log\left(\frac{a+b}{3}\right) = \frac{1}{2}(\log a + \log b)$ , then prove that  $\frac{a}{b} + \frac{b}{a} = 7$ .
- (2) Solve:  $\frac{4\log 3 \times \log x}{\log 9} = \log 27$ .
- (3) How many spherical balls of radius one cm can be made from cube of length 22 cm? ( $\pi=\frac{22}{7}$ )

**Q.3 (a)** Attempt any Two: 06

$$(1) \text{ prove that if } \begin{vmatrix} a & b & b \\ b & a & b \\ b & b & a \end{vmatrix} = 0 \text{ then } a = b \text{ or } a = -2b$$

$$(2) \text{ If } A = \begin{bmatrix} 1 & 3 \\ 2 & -1 \end{bmatrix} \text{ then prove that } A^2 - 7I_{2x2} = \mathbf{0}.$$

$$(3) \text{ Find the inverse matrix } \begin{bmatrix} 3 & -1 & 2 \\ 4 & 1 & -1 \\ 5 & 0 & 1 \end{bmatrix}$$

**(b)** Attempt any Two: 08

$$(1) \text{ Solve: } 2x - y = 4 \text{ and } 3x + y = 1, \text{ Using matrix method.}$$

$$(2) \text{ If } A \alpha = \begin{bmatrix} \cos \alpha & \sin \alpha \\ -\sin \alpha & \cos \alpha \end{bmatrix} \text{ then Show that } A \alpha \cdot A \beta = A \alpha + \beta$$

$$(3) \text{ If } A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ 2 & 2 & 1 \end{bmatrix} \text{ and } B = \begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \\ 1 & -1 \end{bmatrix} \text{ then find } AB \text{ and } BA$$

**Q.4 (a)** Attempt any Two:

**06**

(1) Prove that  $\tan 57^\circ = \frac{\cos 12^\circ + \sin 12^\circ}{\cos 12^\circ - \sin 12^\circ}$

(2) Simplify:  $\frac{\sin(180 - \theta) \cdot \cos(270 - \theta) \cdot \csc(90 + \theta)}{\sec(270 + \theta) \cdot \cot(90 + \theta) \cdot \tan(360 - \theta)}$

(3) Show that  $\tan^{-1}(\infty) + \sin^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right) + \cos^{-1}\left(\frac{1}{2}\right) = \frac{7\pi}{6}$

**(b)** Attempt any Two:

**08**

(1) Draw the graph of  $y = \sin x$ , where  $0 \leq x \leq 2\pi$

(2) If  $\tan \theta = \frac{2}{3}$ ,  $0 \leq \theta \leq \frac{\pi}{2}$  then find the value of  $2\sin 2\theta + 3\cos 2\theta$ .

(3) Prove that  $\sin 4\theta = 4\sin \theta \cos^3 \theta - 4\sin^3 \theta \cos \theta$

**Q.5 (a)** Attempt any Two:

**06**

(1) If  $\bar{a} = (3, -1, -4)$ ,  $\bar{b} = (-2, 4, -3)$  and  $\bar{c} = (-1, 2, -5)$  then find the modulus of  $\bar{a} + 2\bar{b} - \bar{c}$ .

(2) Find the unit vector perpendicular to the plan of vector

$\bar{a} = (1, 2, 3)$  and  $\bar{b} = (-2, 1, -2)$ .

(3) For what value of  $x$ , the vectors  $2\mathbf{i} + 3\mathbf{j} - \mathbf{k}$  and  $x\mathbf{i} - \mathbf{j} + 3\mathbf{k}$  are perpendicular to each other?

**(b)** Attempt any Two:

**08**

(1) A particle is displaced from the point  $(0, 1, -2)$  to the point  $(-1, 3, 2)$  under the action of applied forces  $(1, 2, 3)$ ,  $(-1, 2, 3)$  and  $(-1, 2, -3)$  then find the work done.

(2) If  $\bar{a} = (-4, 9, 6)$ ,  $\bar{b} = (0, 7, 10)$  and  $\bar{c} = (-1, 6, 6)$  then show that  $(\bar{a} \cdot \bar{c}) \cdot (\bar{b} \cdot \bar{c}) = 0$ .

(3) Prove that the Angle between two vectors  $\mathbf{i} + 2\mathbf{j}$  and  $\mathbf{i} + \mathbf{j} + 3\mathbf{k}$  is

$$\sin^{-1} \sqrt{\frac{46}{55}}$$

\*\*\*\*\*

**Q.1** યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પુરો.

**14**

- (1)  $\log_{\alpha} \frac{1}{\alpha}$  ની કિનમત \_\_\_\_\_.  
 (a) 0 (b) 1 (c) -1 (d) 2
- (2) જો  $\log_a 32 = 5$  તો  $a = \underline{\hspace{2cm}}$ .  
 (a) 2 (b) 0 (c) 1 (d) -2
- (3)  $a^{\log_a b} = \underline{\hspace{2cm}}$ .  
 (a) 0 (b) a (c) b (d) 1
- (4) જો  $A = \begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$  તો  $A^T = \underline{\hspace{2cm}}$ .  
 (a)  $\begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$  (b)  $\begin{bmatrix} 0 & 0 \\ 0 & 0 \end{bmatrix}$  (c)  $\begin{bmatrix} 1 & 0 \\ 1 & 0 \end{bmatrix}$  (d)  $\begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$
- (5) નિશ્ચાયક  $\begin{vmatrix} \log_6 3 & -1 \\ \log_6 2 & 1 \end{vmatrix}$  નું મુલ્ય = \_\_\_\_\_ છે. .  
 (a) 0 (b) -1 (c) 1 (d) 2
- (6) જો  $A = \begin{bmatrix} 2 & 1 \\ 5 & 3 \end{bmatrix}$  અને  $B = \begin{bmatrix} 3 & -1 \\ -5 & 2 \end{bmatrix}$  તો  $AB = \underline{\hspace{2cm}}$ .  
 (a)  $\begin{bmatrix} 0 & 0 \\ 0 & 1 \end{bmatrix}$  (b)  $\begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$  (c)  $\begin{bmatrix} 1 & 0 \\ 1 & 0 \end{bmatrix}$  (d)  $\begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$
- (7) જો  $\begin{vmatrix} x & 3 \\ -2 & 2 \end{vmatrix} = 2$  તો  $x = \underline{\hspace{2cm}}$ .  
 (a) 2 (b) -1 (c) -2 (d) -3
- (8)  $3\cos 2x$  નું આવર્તમાળ \_\_\_\_\_ છે. .  
 (a) 0 (b)  $\pi$  (c)  $2\pi$  (d)  $3\pi$
- (9) જો  $\cos \theta + \sin \theta = 2$  તો  $\sin 2\theta = \underline{\hspace{2cm}}$ .  
 (a) 1 (b) 2 (c) 3 (d) 4
- (10)  $135^\circ = \underline{\hspace{2cm}}$  radian.  
 (a)  $\frac{\pi}{4}$  (b)  $\frac{3\pi}{4}$  (c)  $\frac{5\pi}{4}$  (d)  $\frac{5\pi}{6}$
- $\tan^{-1}\left(\frac{3}{4}\right) + \tan^{-1}\left(\frac{4}{3}\right) = \underline{\hspace{2cm}}.$   
 (a)  $\frac{\pi}{2}$  (b)  $\frac{3\pi}{2}$  (c)  $\pi$  (d) 0
- (11)  $4\pi$  સેમી લંબા સળીયા માંથી બનતા વર્તુલ નું ક્ષેત્રફળ = \_\_\_\_\_.  
 (a)  $\pi$  (b)  $4\pi$  (c)  $2\pi$  (d)  $3\pi$
- 4મી. ત્રિજ્યા અને 12 મી ઉંચાઈ ધરાવતા શંકુ નું ધનકળ \_\_\_\_\_ ધન મી.છે
- (12)  $5$  સેમી લંબાઈ ના સમઘન ની સપાટી નું પુષ્ટકળ \_\_\_\_\_ ચોરસ  
 (13) સેમી.છે.  
 (a) 25 (b) 125 (c) 100 (d) 150

(14

)

**Q.2 (a) ગમે તે બે ગણો.:****06**

(1) ઉકેલો :  $\log_2(x+5) + \log_2(x-2)=3.$

(2) એક બંધ અર્ધગોલક ની સપાટી નું પુષ્ટકળ 462 ચોરસ સેમી.છે, તો

ગોલક નો વ્યાસ શોધો. ( $\pi=\frac{22}{7}$ )

(3) કોલેજ માં વર્તુળાકાર કોમન પ્લોટ નો વ્યાસ 42 મી છે, જેની સપાટી પર 10 સેમી. માટી પાથરવા માટે કેટલા ઘનમીટર માટી જોઇએ? ( $\pi=\frac{22}{7}$ )**(b) ગમે તે બે ગણો.:****08**

(1) જો  $\log\left(\frac{a+b}{3}\right) = \frac{1}{2}(\log a + \log b)$ , તો સાબીત કરો કે  $\frac{a}{b} + \frac{b}{a} = 7.$

(2) ઉકેલો :  $\frac{4 \log 3 \times \log x}{\log 9} = \log 27.$

(3) 22 સેમી. લંબાઈ ના સમધન માંથી એક સેમી.ત્રિજ્યા ના કેટકા ગોળા બને? ( $\pi=\frac{22}{7}$ )**Q.3 (a) ગમે તે બે ગણો.:****06**

(1) જો  $\begin{vmatrix} a & b & b \\ b & a & b \\ b & b & a \end{vmatrix} = 0$  તો બતાવો કે  $a=b$  અથવા  $a=-2b$

(2) જો  $A = \begin{bmatrix} 1 & 3 \\ 2 & -1 \end{bmatrix}$  હોય તો સાબીત કરો કે  $A^2 - 7I_{2x2} = \mathbf{0}.$

(3)  $\begin{bmatrix} 3 & -1 & 2 \\ 4 & 1 & -1 \\ 5 & 0 & 1 \end{bmatrix}$  નો વ્યસ્ત શ્રેણિક મેળવો.

**ગમે તે બે ગણો.:****(b)**

(1) શ્રેણિક ની રીતે સમીકરણો ના ઉકેલ મેળવો :

**08**

2x - y = 4 અને 3x + y = 1 .

(2) જો  $A\alpha = \begin{bmatrix} \cos \alpha & \sin \alpha \\ -\sin \alpha & \cos \alpha \end{bmatrix}$  તો બતાવો કે  $A\alpha \cdot A\beta = A\alpha + \beta$

(3) જો  $A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ 2 & 2 & 1 \end{bmatrix}$  અને  $B = \begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \\ 1 & -1 \end{bmatrix}$  હોય તો  $AB$  અને  $BA$

શોધો.

**Q.4 (a) ગમે તે બે ગણો.:**

**06**

$$(1) \text{ સાબીત કરો } \tan 57^\circ = \frac{\cos 12^\circ + \sin 12^\circ}{\cos 12^\circ - \sin 12^\circ}$$

$$(2) : \text{સાફુરૂપ આપો : } \frac{\sin(180-\theta).\cos(270-\theta).\cos ec(90+\theta)}{\sec(270+\theta).\cot(90+\theta).\tan(360-\theta)}$$

$$(3) \text{ બતાવો કે } \tan^{-1}(\infty) + \sin^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right) + \cos^{-1}\left(\frac{1}{2}\right) = \frac{7\pi}{6}$$

**(b) ગમે તે બે ગણો.:**

**08**

$$(1) y = \sin x \text{ નો આલેખ દોરો. જ્યાં, } 0 \leq x \leq 2\pi$$

$$(2) જો \tan \theta = \frac{2}{3}, 0 \leq \theta \leq \frac{\pi}{2} \text{ તો } 2\sin 2\theta + 3\cos 2\theta \text{ ની કિંમત શોધો.}$$

$$(3) \text{ સાબીત કરો કે } \sin 4\theta = 4\sin \theta \cos^3 \theta - 4\sin^3 \theta \cos \theta$$

**Q.5 (a) ગમે તે બે ગણો.:**

**06**

$$(1) જો \bar{a} = (3, -1, -4), \bar{b} = (-2, 4, -3) \text{ અને } \bar{c} = (-1, 2, -5) \text{ હોય તો .}$$

સદિશ  $\bar{a} + 2\bar{b} - \bar{c}$  નુ માન શોધો

$$(2) \text{ સદિશો } \bar{a} = (1, 2, 3) \text{ અને } \bar{b} = (-2, 1, -2) \text{ ને લંબ એકમ સદિશ શોધો.}$$

$$(3) x \text{ ની કષ કિંમત માટે સદિશો } 2i+3j-k \text{ અને } xi-j+3k \text{ પરસ્પર લંબ બને?$$

**(b) ગમે તે બે ગણો.:**

**08**

$$(1) \text{ એક પદાર્થ પર ત્રણ બળો } (1, 2, 3), (-1, 2, 3) \text{ અને } (-1, 2, -3)$$

લગાડતા તે પદાર્થ બિંદુ  $(0, 1, -2)$  થી બિંદુ  $(-1, 3, 2)$  પર

સ્થાનાંતર કરે છે ,તો તે પદાર્થ પર થતુ કાર્ય શોધો

$$(2). \text{ જો સદિશો } \bar{a} = (-4, 9, 6), \bar{b} = (0, 7, 10) \text{ અને } \bar{c} = (-1, 6, 6)$$

હોય તો બતાવો કે  $(\bar{a} - \bar{c})(\bar{b} - \bar{c}) = 0$ .

$$(3) \text{ બે સદિશો } i+2j \text{ અને } i+j+3k \text{ વચ્ચે નો ઝુણો } \sin^{-1} \sqrt{\frac{46}{55}} \text{ શાય}$$

એમ સાબીત કરો

\*\*\*\*\*